



ઓનલાઇન ફટાકડાં વિક્રેતા તાલીમ ચાલુ છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 7, 2021) – સીટી ઓફ બ્રેમ્પટનની ઓનલાઇન તાલીમ પ્રક્રિયા એ વિક્રેતાઓ માટે ચાલુ અને ઉપલબ્ધ છે જેઓની નવેમ્બર 4 નાં રોજ દિવાળી અને ડિસેમ્બર 21 નાં રોજ ન્યૂ ઈયર્સ ઈવ માટે ફટાકડા વેચવાની યોજના હોય. આવી જ તાલીમ આ વર્ષે અગાઉ વિક્ટોરિયા ડે અને કેનેડા માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી.

આ તાલીમ ફરજિયાતપણે લેવાની રહે છે અને વિક્રેતાઓને વેચાણ કરવાનું લાઇસન્સ આપી શકાય તે પહેલાં આ અભ્યાસક્રમ ફરજિયાત લેવાનો રહે છે.

અભ્યાસક્રમ માટે નોંધણી કરાવવા, વિક્રેતાઓ બ્રેમ્પટન ફાયર પ્રિવેન્શનને 905.874.2740 નંબર પર કૉલ અથવા ઈમેઇલથી fire.prevention@brampton.ca પર સંપર્ક કરી શકે છે અને અરજદારને અભ્યાસક્રમની વિગતો ઈમેઇલથી મોકલવામાં આવશે.

COVID-19 માટે આરોગ્ય અને સુરક્ષા પ્રતિબંધો અમલમાં હોવાને લીધે, તાલીમ ઓનલાઇન સ્વરૂપે પાંચ સરળ પગલાઓમાં આપવામાં આવશે:

1. 2021 ફાયરવર્ક્સ રિટેઇલર કોર્સ માટે ચૂકવણી કરો અને [ફાયર ઈન્સ્પેક્શન](#) માટે અરજી કરો
2. ફાયરવર્ક્સ રિટેઇલર તાલીમ વીડિયો જુઓ
3. ફાયરવર્ક્સ રિટેઇલર પ્રશ્નાવલી ભરો
4. લાઇસન્સ અરજી અને નોંધણી ફી જમા કરાવો. વિગતો માટે ઈમેઇલથી licensing@brampton.ca સરનામે સંપર્ક કરો.
5. 2021 ફાયરવર્ક્સ રિટેઇલર લાઇસન્સ રૂબરૂમાં સીટી હોલમાંથી મેળવો. હોલની મુલાકાત લેતા પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી અનિવાર્ય છે અને તેનું બુકિંગ અહીં કરી શકાય છે, www.brampton.ca/skiptheline.

ફટાકડા વિક્રેતા તાલીમમાં વેચાણ કરવાની છૂટ અપાતા ફટાકડાના પ્રકારો, સંગ્રહ કરવાને લગતા નિયમો, ફટાકડાનું પ્રદર્શન અને વેચાણ, ગ્રાહક આઈડી જરૂરિયાતો અને ખરીદનારાઓને વિતરણ માટે સુરક્ષા માર્ગરેખાઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.

બહુવિધ સ્થળોમાં કાર્યરત વિક્રેતાઓ માટે, અભ્યાસક્રમ પૂરો કરવા દરેક સ્થળે ઓછામાં ઓછાં એક ઓપરેટરની જરૂર પડે છે. વિક્રેતાઓએ ફાયર ઈન્સ્પેક્શન માટે અરજી કરવા નીચેની અંતિમ તારીખો પણ નોંધવી રહી, જે [ઓનલાઇન](#) કરી શકાય છે:

- શુક્રવાર, ઓક્ટોબર 15, 2021 - દિવાળીમાં ફટાકડાં માટે
- શુક્રવાર, ડિસેમ્બર 10, 2021 - ન્યૂ ઈયર્સ ઈવ પર ફટાકડાં માટે

સીટી ઓફ બ્રેમ્પટનનો બાય-લો (પેટા-કાનૂન) માત્ર ટૂંકા અંતરના ફટાકડાનું વેચાણ અને અંગત વપરાશ (ફોડવામાં આવે ત્યારે 3 મીટર કે 10 ફૂટથી ઓછાં અંતર સુધી ઉડે તેવા ફટાકડા) વર્ષમાં ચાર વખત - વિક્ટોરિયા ડે, કેનેડા ડે, દિવાળી અને નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ કરવાની પરવાનગી આપે છે.



BRAMPTON

Service and Information Update

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्युडान्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca